

ओम् गुरु ओम्
॥ तस्य वाचकः प्रणवः ॥

श्री गुरुदेव शुभेच्छा वर्ष - ८५ मुं



प. पू. गुरुदेव श्री योगभिक्षु

घांथी, मोथी, दरज्ज केरां; भले काज करे अनंत;
संतस्वभाव पलटे नहीं तोये, रडे संतनो संत.

डिग्री न पूछवी संतो केरी, मेणवी लेवुं ज्ञान;
मूढ्य करवुं तलवारनुं, रडेवा देवुं म्यान.

संत, महंत, संन्यासी थई, भले मोटां मांडे डग;
भग-स्वभाव सुधरे नहि तोये, रडे ठगनो ठग.

- योगभिक्षु

पारसमणी के स्पर्श से, कंयन भयी तलवार;
तुलसी तीनो ना गये; धार, मार, आकार.

॥ ॐ ॥
॥ तस्य वाचकः प्रणवः ॥

गुरुपूर्णिमा - महोत्सव

(समस्त ओम्परिवारने निमंत्रण)

पूज्य / प्रिय-सत्यधर्मप्रेमीश्री,

परम गुरु प्रणवपरमात्मान्नी अहैतुकी कृपाथी अने प.पू. गुरुदेवश्रीनी निश्रामां गुरुपूर्णिमा-महोत्सव ऒजववानुं निरधारेल छे. महोत्सवमां गुरुसत्संगनो, गुरुपूजननो तथा गुरुप्रसाद (भोजनप्रसाद)नो लाभ जरूर लईअे. सत्संगप्रेमीओ निमंत्रणनी राह जोवा रोकाता नथी.

गुरुपूजनविधिनो लाभ लेवो के नछि ते माटे सौ स्वतंत्र छे. भोजनप्रसादनो लाभ जरूर लो तेवो अमारो विनंती सह अतिआग्रह छे.

तारीख : २२-७-२०१३ ने सोमवार
समय : सवारे ८.०० थी अपोरे २.००
स्थल : मणिभात्मवन, कर्णावती इलेटनी बाजुमां,
राजेश्वरी कोलोनी सामे, यंडोणातणाव पासे,
ईसनपुर कांस उपर, मणीनगर,
अमदावाद - ३८०००८.

ओम्परिवार वती,
महोत्सव-प्रबंधक समितिना
जयनारायण जय ओम् गुरुदेव

गुरुपूर्णिमा निमित्ते
वंदन - अभिनंदन - आशिष

ભિખારી જ રહ્યા!

લોકો, ગુરુસંતો પાસે પણ ભૌતિક-લૌકિક ઈચ્છાની પૂર્તિ માટે જ જતા હોય છે. આ ઘણું મોટું અજ્ઞાન છે, ઘણો મોટો નુકસાનીનો સોદો છે, કાંચનને બદલે કાચ લીધા બરાબર છે. પોતાના પ્રયત્ન દ્વારા પ્રાપ્ત ન થઈ શકે એવું જે અધ્યાત્મજ્ઞાન, એવું જે તત્ત્વજ્ઞાન, એવું જે આત્મા-પરમાત્માનું જ્ઞાન, એવું જે મોક્ષપ્રાપ્તિનું રહસ્યજ્ઞાન વગેરેની પ્રાપ્તિ માટે ગુરુસંતોની સહાયતા લેવી યોગ્ય ગણાય. આધ્યાત્મિક જનો પાસેથી શું ઈચ્છવું જોઈએ તે માટે પણ સાચા સલાહકારની સલાહની જરૂર પડે છે. નહિ તો સ્થિતિ પેલા ભિખારી જેવી થાય.

એક ભિખારી હતો. રાજા તેના પર કાંઈ કારણસર પ્રસન્ન થયા. રાજા કહે: “માગ-માગ, જે માગે તે આપું.” ભિખારી કહે: “આપને જે આપવું હોય તે આપો.” રાજા વિચાર કરે છે કે, “હું રાજા, હું જેના પર પ્રસન્ન થાઉં તેને જો ભિખારી રહેવા દઉં તો મારું રાજપશું લાજે. આજે તો આને પાંચ ગામ આપી દઉં.” પણ પછી તેને વિચાર આવ્યો કે, “રખેને ભિખારીને પાંચ ગામ કરતાં પણ કંઈક વિશેષ જોઈતું હોય તો?” તેથી ભિખારીને ફરીને કહ્યું કે, “તું તારા મોઢેથી માગી લે, તું માગે તે મારે આપવું.” રાજા તે દિવસે ખૂબ પ્રસન્ન હતા. ભિખારી જે માગે તે આપી દેવા તૈયાર હતા. ભિખારી વિચાર કરે છે કે “શું માગું?” તેણે પોતાના મિત્રની સલાહ લીધી. તેનો મિત્ર થોડો બુદ્ધિશાળી હતો. દરેક મોટા અને મહત્વના કાર્યમાં જાણકારોની સલાહ લેવાથી કામ સુધરે છે. ભિખારીના મિત્રે વિચાર કર્યો કે, “આ મારો ભિખારી મિત્ર, આખા દિવસના માંડ બે રૂપિયા મેળવે છે, તે રાજા પાસે માગી-માગીને શું માગશે? એના કરતાં રાજા પોતે જ નક્કી કરીને આપે તો ભિખારી ન્યાલ થઈ જાય”. તેથી રાજા અને તેની વચ્ચે રક્કડ ચાલી. રાજા કહે: “તું માગ” અને ભિખારી-મિત્ર કહે: “આપને યોગ્ય લાગે તે આપો.” આ બંનેની રક્કડ સાંભળીને ભિખારીની ધીરજ ખૂટી. એને થયું કે આવી રક્કડથી કદાચ બધુંય ખોઈશું. મારે તો એક હજાર રૂપિયા જોઈએ છે અને જો રાજા પાંચ-પચ્ચીસ રૂપિયા જ આપશે તો પછી કાંઈ નહિ બોલાય. આમ વિચારીને તે વચ્ચે જ બોલી ઊઠ્યો કે, “આપ મારા પર ખરેખર જો પ્રસન્ન થયા હો તો મને એક હજાર રૂપિયા આપો. રાજાએ તુરત હજાર રૂપિયા આપી દીધા. એ હજાર રૂપિયામાંથી ભિખારીએ એક મહિના સુધી જલસા કર્યા અને પછી હતો એવો ને એવો કડકાબાલૂસ થઈ ગયો!

દિવસમાં માત્ર બે રૂપિયા જ મેળવતો હતો, એટલે ભિખારીને હજાર રૂપિયા ઘણા લાગ્યા. તેથી તેના પર રાજા પ્રસન્ન

થયા છતાં પણ તે ભિખારી જ રહ્યો. તેમ આપણે પણ ગુરુસંતો પાસેથી અલૌકિક પ્રાપ્તિઓ પ્રાપ્ત કરીને અલૌકિક નથી બની જતા - રાજા નથી બની જતા, પણ ભિખારી જ રહીએ છીએ! અસ્તુ.- પ. પૂ.

શ્રી ગુરુદેવ યોગભિક્ષુજીના 'વીજળીના ઝબકારે' પુસ્તકમાંથી સાભાર

જીવન-પાથેય

- યોગભિક્ષુ

- જેમ કમળાનો રોગ થાય ત્યારે મનુષ્ય, રોગ મટે નહિં ત્યાં સુધી આખા જગતને પીળું જ ભાળે છે; તેમ બુદ્ધિમાં વિકૃતિ પેસે પછી સવળું બધું અવળું દેખાય છે, મિત્ર પણ દુશ્મન દેખાય છે!
- “મોચીની દાઝે કાંટામાં ચાલવાથી” આપણને જ નુકસાન થાય છે એ વાતને ધીરજપૂર્વક સમજાવે.
- અશક્યની તીવ્ર ઈચ્છા મનુષ્યની બુદ્ધિને ભ્રમવાદી દે છે. પછી તે મનુષ્ય સારાસારનો વિવેક ચૂકી જાય છે અને તેથી પોતાને બેસવાની ડાળને પહેલી કાપે છે.
- કોઈ કોઈ મનુષ્યનો એવો સ્વભાવ હોય છે કે તે શઠ માણસનું ખોટું વર્તન પણ સહન કરી લે છે, પણ સરળ સ્વભાવના મનુષ્યના સારા વર્તનની પણ તે ટીકા કરે છે અને તેની સહાનુભૂતિના બદલામાં તેને ગાળો ભાંડે છે!
- સાચી કે ખોટી આપણી ‘હા એ હા’ કરે એવા જ મનુષ્યો આપણને ગમે છે અને તેમ ન કરનાર દુશ્મન જેવા લાગે છે. પણ, સમય જતાં ખબર પડે છે કે, એ દુશ્મન જેવા લાગતા મનુષ્યે આપણી “હા એ હા” ન કરી તેથી જ આપણું કલ્યાણ થયું. તુરત મળતા એક રૂપિયાના લાભ કરતાં વિલંબથી મળતા લાખો રૂપિયાના લાભને જોઈ શકે તેવી બુદ્ધિ કેળવવી જોઈએ.
- માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય અને અભિમાનથી ફુલાતો હોય પણ કુદરત પાસે તેનું ગજું કેટલું? “કુદરત પાસે તો પોતે એક રમકડું જ છે”. - એટલી જો તેને ખબર પડી જાય, તો તેનો જન્મ સફળ થઈ જાય. પણ, ઓછી સમજના કારણે વાત તે સમજી શકતો નથી કે તેને કોઈ સમજાવી શકતું નથી. આપણે સૌ પણ દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે પરસ્પરનાં રમકડાં જ છીએ એ વાત જીવનનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવાથી આપણને જણાઈ આવે છે.

• સત્સાહિત્ય પ્રચાર પત્રિકા નં. ૧૧૪, તા. ૨૫-૦૬-૨૦૧૩ •

પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન:- ઓમ્ગુરુ પ્રેમસમર્પણધ્યાનભિક્ષુ પરિવાર ટ્રસ્ટ વતી
ડૉ. સદ્ગુરુ સમર્પણ ભિક્ષુ ૩/બ, પલિયડનગર, દર્પણ સર્કલ પાસે, નારણપુરા, અ'વાદ-૧૩